



# Axel Polymers Limited

Regd. Office & Works : 309, Mokshi, Sankarda-Savli Road, Tal. Savli,  
Dist. Vadodara - 391780, India. • Telefax : +91-2667-244395, 244438  
info@axelindia.com • www.axelindia.com • CIN : L 25200GJ1992PLC017678

21.01.2021

To,  
Corporate Relationship Department,  
BSE Limited. 14th Floor,  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street, Fort  
Mumbai – 400 001

**BSE Scrip Code - 513642**

Dear Sir,

**Sub: News Paper Advertisement for NCLT convened meetings of Equity Shareholders, Unsecured Creditors & Secured Creditors of Axel Polymers Limited.**

Dear Sir,

Pursuant to the Regulations 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with Orders dated 18.12.2020 of Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench ('NCLT') we enclose herewith copies of newspaper advertisement published on 14.01.2021 in 'Business Standard' English (Ahmedabad Edition) and 'Loksatta Jansatta' Gujarati (Ahmedabad Edition), intimating that NCLT convened meetings of Equity Shareholders, Unsecured Creditors & Secured Creditors of the Company are scheduled to be held on Wednesday, the 17th day of February, 2021 at 4:00 p.m. (IST) through Video Conferencing or Other Audio Visual Modes, to considering and if thought fit, to approve with or without modification(s), the Scheme of Amalgamation of Dhara Petrochemicals Private Limited with Axel Polymers Limited and their respective shareholders and creditors ("Scheme of Amalgamation" or "Scheme") under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the rules made thereunder.

This is for your information and record.

Thanking you,

**For Axel Polymers Limited**

**Jigardan Gadhvi**  
**Company Secretary**



**Encl: As above**

**ZAMPA BAZAR BRANCH, Faize E Qutbi Building, Begumpura, Amkhas, Surat - 395003 Tel - 0261 2321978 / 2355612, Email : dzamp@bankofbaroda.co.in**

**POSSESSION NOTICE (Immovable Property)**

Whereas the undersigned being the Authorized Officer of the Bank of Baroda (erstwhile Dena Bank amalgamated into Bank of Baroda with effect from 1st April 2019 in term of Gazette of India No. GSR No. 2E dated 2<sup>nd</sup> January 2019 issued by Ministry of Finance, Government of India) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 17.09.2018 calling upon the Borrowers / Guarantor Creditor (1) Mrs. Sabita Rahul Singh And Mr. Rahul Kumar Naresprasad Singh (Borrowers) (2) Mr. Jaynarayan Shyamund Singh (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 15,79,735.00 (Rupees Fifteen Lakh Seventy Nine Thousand Seven Hundred Thirty Five Only) along with further interest w.e.f. 10.03.2018 plus charges pending thereon within 60 days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section (4) of section 13 of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 on this 08<sup>th</sup> Day of January of the year 2021. The Borrower/Guarantor/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, (e-Dena) Zampa Bazar Branch for an amount of Rs. 15,79,735.00 (Rupees Fifteen Lakh Seventy Nine Thousand Seven Hundred Thirty Five Only) along with further interest w.e.f. 10.03.2018 at contractual rate plus cost, charges and expenses till date of payment. The Borrower's Attention is invited to Provision Of Sub-Section (8) Of Section 13 Of The Act, In Respect Of Time Available, To Redeem The Secured Assets.

**Description of immovable property**

Plot No. 213, (As per K.J.P Record Block No. 148/213, admeasuring Sq.Mtrs. of the society known as "Hankrushna Residency situated at Haldaru Patia, B/H, Sarvottam Hotel, Kadodara-Bardoli Road, bearing Revenue Survey No. 115, Block No. 148 of Village Bagumara, Taluka : Palsana, District : Surat total admeasuring about 72.00 Sq.Yds. i.e. 60.20 Sq.Mts in the name of Mrs. Sabita Rahul Kumar Singh.

Date : 08/01/2021 Authorized Officer  
Place : Surat Bank of Baroda, Zampa Bazar Branch (eDena), Surat.

**Chalthan Branch, Shop No: 1, To 5 Sai Vatika, Opp Chokhidhani Hotel, Surat, Gujarat-394305, Ph.No.02622-281101, Email -VJCHAL@bankofbaroda.com**

**POSSESSION NOTICE (Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)**

Whereas the undersigned being the authorized officer of the BANK OF BARODA (E-VIJAYA BANK) CHALTHAN BRANCH SHOP NO. 1 TO 5, SAI VATIKA OPP CHOKHADHANI HOTEL, SURAT GUJARAT-394305 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 01/01/2020 Calling upon the Borrowers MR. RAMPYARE SYAMDEV MEHTA (BORROWER) & MRS. AMRITA RAMPYARE MEHTA (GUARANTOR) to repay the amount mentioned in the notice being Rs. 3,86,670.07/- (RUPEES THREE LAKH EIGHTY SIX THOUSAND SIX HUNDRED SEVENTY & PAISE SEVEN ONLY) as on 01/01/2020 with future interest and incidental charges w.e.f. 01/01/2020, Less credits, if any. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower / Guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 12<sup>th</sup> Day of JANUARY of the year 2021. The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the BANK OF BARODA (E-VIJAYA BANK) CHALTHAN BRANCH SHOP NO. 1 TO 5, SAI VATIKA OPP CHOKHADHANI HOTEL, SURAT GUJARAT-394305 for an amount of Rs. 3,86,670.07/- (RUPEES THREE LAKH EIGHTY SIX THOUSAND SIX HUNDRED SEVENTY & PAISE SEVEN ONLY) as on 01/01/2020 with future interest and incidental charges w.e.f. 01/01/2020, Less credits, if any. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of immovable property**

BLOCK NO. 71, FLAT NO. 410, SHITAL APARTMENT MOJE: KADODARA, TALUKA: PALSANA, DIST: SURAT, GUJARAT-394305  
Boundaries: On the North by - LAND OF VIDYAPITH, On the South by - INTERNAL ROAD & MAITRI APARTMENT, On the East by - MAIN ROAD & INTERNAL ROAD, On the West by - SARJAN APARTMENT

Date : 12/01/2021 Authorized Officer  
Place : Surat Bank of Baroda,

**સરકારી બેંક Canara Bank**  
**VALSAD BRANCH**

**POSSESSION NOTICE (Section 13(4)) (For Immovable property)**

Whereas the undersigned being the Authorized Officer of the Canara Bank under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 14-01-2020 calling upon the borrower Mr. Chirag D Desai S/o Dhananjay V Desai to repay the amount mentioned in the notice being Rs. 40,74,273.77/- (Rupees Ten Lakh Seventy Four Thousand Two Hundred Seventy Three and Seventy Seven paise only) exclusive of legal exp plus further interest thereon within 60 days from the date of receipt of the said notice. The borrower/ guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor and the public in general, that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said rule on this 12th Day of January of the year 2021. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Canara Bank (name of the institution) for an amount of Rs. 40,99,299.77 (Rupees Ten Lakh Ninety Nine Thousand Two Hundred Ninety Nine and Seventy Seven paise only) as on 14.12.2020 and interest thereon. The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All that part and parcel of the property consisting of Flat No. 207 on the 2nd floor admeasuring area 83.61 sq mts. With proportionate undivided share in the land building known as "SHUBH MANGAL APARTMENT" within the Registration Taluka Valsad and District - Valsad, Survey No 282/1, Paiky/Paiky 23,24,25 N/A, Plot No. 22,23,24, Flat No. 207, 2nd Floor SHUBH MANGAL APARTMENT, At: Nandavala, Taluka and District Valsad, Village Nandavala, Taluka Valsad, District Valsad, Bounded as follows: North : Flat No 206, South : Margin Place of Plot no 22,23,24, East : Margin Place of Plot no 22,23,24, West: FLAT NO 208

Date : 12-01-2021 Authorized Officer  
Place : VALSAD CANARA BANK

**FORM NO. CAA 2**  
[Pursuant to Section 230(3) and rule 6 and 7]  
CA (CAA) NO. 86/NCLT/AHM/2020

Axel Polymers Limited...Applicant Company 2/ Transferor Company

**Notice and Advertisement of Notice of meeting**

Notice is hereby given that by an Order dated 18<sup>th</sup> December 2020, the Ahmedabad Bench of National Company Law Tribunal ("Tribunal") has directed meetings of Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors ("the Stakeholders") of Applicant Company 2 to be held for the purpose of considering, and if thought fit, approving with or without modification, the proposed Scheme of Amalgamation of Dharma Petrochemicals Private Limited with Axel Polymers Limited and their respective shareholders and creditors.

In pursuance of the said Order and as directed therein, further notice is hereby given that the meetings of Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors of the Applicant Company 2, will be held on 17<sup>th</sup> day of February, 2021 at 11:30 AM, 4:00 PM and 2:30 PM respectively through Audio Visual Means, at which time and date, the said Equity Shareholders, Secured Creditors and Unsecured Creditors are requested to attend.

In accordance with the relevant circulars, Notice of the meeting along with the Scheme of Amalgamation and explanatory statement is being sent by electronic mode to those Stakeholders whose e-mail addresses are registered with the Applicant Company 2/Depository. Notice of respective meetings and Scheme of Amalgamation along with explanatory statement will also be available on the Applicant Company 2's website, www.axelindia.com and on the website of the BSE Limited, www.bseindia.com and also on the website of NDSL (agency for providing the remote e-Voting facility) i.e. www.evoting.ndsl.com.

Copies of the said compromise or arrangement, and the Explanatory Statement under section 230 read with Section 232 and applicable Rules of the Companies Act, 2013 can be obtained free of charge at the registered office of the Applicant Company 2 or at the office of its advocate viz. Thakkar and Pahwa, Advocates, 71, New York Tower - A, Opposite Muktihand Derasar, Thaltej, Ahmedabad - 380054 between 11:00 AM to 6:00 PM on all working days (except Sunday).

Stakeholders can attend and participate in the meeting through the VC/OAVM facility only. In respect of Stakeholders as on 30<sup>th</sup> November 2020, who have not registered their e-mail addresses with the Applicant Company 2/Depository, the physical copy of the notice would be sent to the last known address as available with the Applicant Company 2.

The Applicant Company 2 is providing remote e-voting facility to Secured Creditors and Unsecured Creditors as on cut-off date i.e. 30<sup>th</sup> November, 2020 and for Equity Shareholders as on cut-off date i.e. 5<sup>th</sup> February, 2021 to approve with or without modification the Scheme of Amalgamation of Dharma Petrochemicals Private Limited with the Applicant Company 2. Additionally, the Applicant Company 2 would be providing the facility of voting through e-voting system during the meeting. The instructions for joining the meeting will be provided in the Notice of the meetings.

Stakeholders attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per order dated 18<sup>th</sup> December 2020 of the Ahmedabad Bench of NCLT.

The Tribunal has appointed Shri A.B. Bodhanwala and in his absence, Shri Gaurav Thanky as Chairman of the said meetings. The abovementioned compromise or arrangement, if approved by the meetings, will be subject to the subsequent approval of the Tribunal.

Mr. A. B. Bodhanwala  
DIN: 00421362  
Dated this 14<sup>th</sup> day of January 2021. Chairman appointed for the Meetings

**The Surat People's Co-op. Bank Ltd.**  
Estd.: 1922 Multi State Scheduled Bank

Regd./Central Office: "Vasudhara Bhavan", Timaliyavard, Nanpura, Surat-395001. Tel.: (+91-0261)246 4621 to 4624 Fax: (+91-0261) 246 4577 & 4592 email: info@spcbli.in | Toll Free: 18002337722 | Website: www.spcbli.in

**APPENDIX-IV (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)**

WHEREAS The undersigned being the Authorized Officer of The Surat People's Co-Op. Bank Ltd. Central Office, "Vasudhara Bhavan", Timaliyavard, Nanpura, Surat-395001 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 had issued demand notice under section 13(2) dated 28/05/2020 Calling Upon the

**Borrower :** (1) Late Bijoykumar Prahladrai Poddar A/C No. 304002990157  
**Legal Heirs & Representatives of Late Bijoykumar Prahladrai Poddar**  
(a) Surendrakumar Bijoykumar Poddar (b) Santoshdevi Bijoykumar Poddar  
**Resi. Add.** (a) & (b) : 704, Amardeep Apartment, Near Umabhavan, Bhatar, Surat.  
(c) Any other's unknown to the bank  
**Guarantors :** (3) Surendrakumar Bijoykumar Poddar (4) Santoshdevi Bijoykumar Poddar

to repay the total amount mentioned in the notice being pay Rs. 3,06,997/36 (Rupees Three Lakh Six Thousand Nine Hundred Ninety Seven and Paise Thirty Six only) as on dt.27/05/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, incurred to be incurred, within sixty days from the date of receipt of the said notice.

Bank has issued demand notice u/s 13(2) to borrower and guarantors on dt.28/05/2020. On that date Bijoykumar Prahladrai Poddar was alive but recently as per information given by you no.(2) Surendrakumar Bijoykumar Poddar to the bank, Bijoykumar Prahladrai Poddar was passed away on dt.19/08/2020 and you no.1(a), 1(b) & Others that are not in knowledge of bank are the legal heirs of late Bijoykumar Prahladrai Poddar. Therefore you no.1(a), 1(b) & Other legal heirs that are not in knowledge of bank are liable for repayment till the amount of ledger outstanding, Interest, Penal interest and other expenses are fully paid up with bank.

The legal heirs of Borrower and Guarantors having failed to repay the amounts, notice is hereby given to them and the public in general that the undersigned has taken SYMBOLIC Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 11th January, 2021.

The legal heirs of Borrower and Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of The Surat People's Co-Op. Bank Ltd. For an amount of Rs. 3,06,997/36 (Rupees Three Lakh Six Thousand Nine Hundred Ninety Seven and Paise Thirty Six only) as on dt.27/05/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, etc. due from the borrower(s) and interest thereon.

The legal heirs of Borrower and Guarantors attention is invited to the provisions of Sub-Section (8) of Section 13 of the SARFESI Act, in respect of time available, to redeem the secured asset.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**  
**Name Of The Owner :** (1) Late Bijoykumar Prahladrai Poddar (2) Pooja Surendra Poddar Flat No. A-1003, 10th Floor, "Keshav Narayan Residency", B/H Ratiraj Apartment, Near Ashinwad Palace, Near Vanita Park, Joggars Park Road, Moje- Bhatar, Tal.-Choryasi, Dist.-Surat, R.S. No. 108, T.P.S. No. 27, F.P.No. 77, Admeasuring : Super Builtup Area : 1850 sqft and Builtup Area : 1150 sqft.

Sd/- Sunil R. Kapadia  
Asst. General Manager & Authorized Officer  
The Surat People's Co-Op. Bank Ltd.

Date : 11/01/2021  
Place : Surat

**The Surat People's Co-op. Bank Ltd.**  
Estd.: 1922 Multi State Scheduled Bank

Regd./Central Office: "Vasudhara Bhavan", Timaliyavard, Nanpura, Surat-395001. Tel.: (+91-0261)246 4621 to 4624 Fax: (+91-0261) 246 4577 & 4592 email: info@spcbli.in | Toll Free: 18002337722 | Website: www.spcbli.in

**APPENDIX-IV (Rule-8(1)) POSSESSION NOTICE (For Immovable Property)**

WHEREAS The undersigned being the Authorized Officer of The Surat People's Co-Op. Bank Ltd. Central Office, " Vasudhara Bhavan ", Timaliyavard, Nanpura, Surat-395001 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 had issued demand notice under section 13(2) dated 28/05/2020 Calling Upon the

**Borrower :** (1) M/s. Shree Ganesh Fabrics A/C No. 304002899791  
**Office / Shop :** 405-08, Super Tex Tower, Opp. Kinnary Cinema, Ringroad, Surat.  
**Proprietor :** Late Bijoykumar Prahladrai Poddar  
**Legal Heirs & Representatives of Late Bijoykumar Prahladrai Poddar**  
(a) Surendrakumar Bijoykumar Poddar (b) Santoshdevi Bijoykumar Poddar  
**Resi. Add.** (a) & (b) : 704, Amardeep Apartment, Near Umabhavan, Bhatar, Surat.  
(c) Any other's unknown to the bank  
**Guarantors :** (2) Surendrakumar Bijoykumar Poddar (3) Pooja Surendra Poddar (4) Santoshdevi Bijoykumar Poddar (5) Nareshkumar Raghunath Dhandhani

to repay the total amount mentioned in the notice being pay Rs. 96,86,213/50 (Ninety Six Lakh Eighty Six Thousand Two Hundred Thirteen And Paise fifty Only) as on dt.27/05/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, incurred to be incurred, within sixty days from the date of receipt of the said notice.

Bank has issued demand notice u/s 13(2) to borrower and guarantors on dt.28/05/2020. On that date Bijoykumar Prahladrai Poddar was alive but recently as per information given by you no.(2) Surendrakumar Bijoykumar Poddar to the bank, Bijoykumar Prahladrai Poddar was passed away on dt.19/08/2020 and you no.1(a), 1(b) & Others that are not in knowledge of bank are the legal heirs of late Bijoykumar Prahladrai Poddar. Therefore you no.1(a), 1(b) & Other legal heirs that are not in knowledge of bank are liable for repayment till the amount of ledger outstanding, Interest, Penal interest and other expenses are fully paid up with bank.

The legal heirs of Borrower and Guarantors having failed to repay the amounts, notice is hereby given to them and the public in general that the undersigned has taken SYMBOLIC Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 11th January, 2021.

The legal heirs of Borrower and Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of The Surat People's Co-Op. Bank Ltd. For an amount of Rs. 96,86,213/50 (Ninety Six Lakh Eighty Six Thousand Two Hundred Thirteen And Paise fifty Only) as on dt.27/05/2020 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs, charges, etc. due from the borrower(s) and interest thereon.

The legal heirs of Borrower and Guarantors attention is invited to the provisions of Sub-Section (8) of Section 13 of the SARFESI Act, in respect of time available, to redeem the secured asset.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**  
**Name Of The Owner :** (1) Late Bijoykumar Prahladrai Poddar (2) Pooja Surendra Poddar Flat No. A-1003, 10th Floor, "Keshav Narayan Residency", B/H Ratiraj Apartment, Near Ashinwad Palace, Near Vanita Park, Joggars Park Road, Moje- Bhatar, Tal.-Choryasi, Dist.-Surat, R.S. No. 108, T.P.S. No. 27, F.P.No. 77, Admeasuring : Super Builtup Area : 1850 sqft and Builtup Area : 1150 sqft.

Sd/- Sunil R. Kapadia  
Asst. General Manager & Authorized Officer  
The Surat People's Co-Op. Bank Ltd.

Date : 11/01/2021  
Place : Surat

**FORM NO. CAA 2**  
[Pursuant to Section 230(3) and rule 6 and 7]  
CA (CAA) NO. 86/NCLT/AHM/2020

Dhara Petrochemicals Private Limited...Applicant Company 1/ Transferor Company

**Notice and Advertisement of Notice of meeting**

Notice is hereby given that by an Order dated 18<sup>th</sup> December 2020, the Ahmedabad Bench of National Company Law Tribunal ("Tribunal") has directed meetings of Secured Creditors and Unsecured Creditors ("the Stakeholders") of the Applicant Company 1 to be held for the purpose of considering, and if thought fit, approving with or without modification, the proposed Scheme of Amalgamation of Dharma Petrochemicals Private Limited with Axel Polymers Limited and their respective shareholders and creditors.

In pursuance of the said Order and as directed therein, further notice is hereby given that the meetings of Secured Creditors and Unsecured Creditors of Applicant Company 1, will be held on 18<sup>th</sup> day of February, 2021 at 11:30 am and 4:00 pm respectively through Audio Visual Means, at which time and date, the said Secured Creditors and Unsecured Creditors are requested to attend.

In accordance with the relevant circulars, Notice of the meeting along with the Scheme of Amalgamation and explanatory statement is being sent by electronic mode to those Stakeholders whose e-mail addresses are registered with the Applicant Company 1 / Transferor Company. Notice of respective meetings and Scheme of Amalgamation along with explanatory statement will also be available on the Applicant Company 1's website, www.dharachemicals.com and on the website of NDSL (agency for providing the remote e-Voting facility) i.e. www.evoting.ndsl.com.

Copies of the said compromise or arrangement, and the Explanatory Statement under section 230 read with Section 232 and applicable Rules of the Companies Act, 2013 can be obtained free of charge at the registered office of the Applicant Company 1 or at the office of its advocate viz. Thakkar and Pahwa, Advocates, 71, New York Tower - A, Opposite Muktihand Derasar, Thaltej, Ahmedabad - 380054 between 11:00 AM to 6:00 PM on all working days (except Sunday).

Stakeholders can attend and participate in the meeting through the VC/OAVM facility only. In respect of Stakeholders as on 30<sup>th</sup> November 2020, who have not registered their e-mail addresses with the Applicant Company 1, physical copy of the notice would be sent to the last known address as available with the Applicant Company 1.

The Applicant Company 1 is providing remote e-voting facility to all Stakeholders as on cut-off date i.e. 30<sup>th</sup> November 2020 to approve with or without modification the Scheme of Amalgamation of the Applicant Company 1 with Axel Polymers Limited. Additionally, the Applicant Company 1 would be providing the facility of voting through e-voting system during the meeting. The instructions for joining the meeting will be provided in the Notice of the meetings.

Stakeholders attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per order dated 18<sup>th</sup> December 2020 of the Ahmedabad Bench of NCLT.

The Tribunal has appointed Shri Gaurav Thanky and in his absence, Ms. Pooja Shah as Chairperson of the said meetings. The abovementioned compromise or arrangement, if approved by the meetings, will be subject to the subsequent approval of the Tribunal.

Mr. Gaurav Thanky  
DIN: 02565340  
Dated this 14<sup>th</sup> day of January 2021 Chairman appointed for the Meetings

**Chalthan Branch, Shop No: 1, To 5 Sai Vatika, Opp Chokhidhani Hotel, Surat, Gujarat-394305, Ph.No.02622-281101, Email -VJCHAL@bankofbaroda.com**

**POSSESSION NOTICE (Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)**

Whereas the undersigned being the authorized officer of the BANK OF BARODA (E-VIJAYA BANK) CHALTHAN BRANCH SHOP NO. 1 TO 5, SAI VATIKA OPP CHOKHADHANI HOTEL, SURAT GUJARAT-394305 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 01/01/2020 Calling upon the Borrowers MR. POKIYA TUSHARBHAI KALUBHAI (BORROWER), MRS. POKIYA SHRODHABEN TUSHARBHAI (CO-APPLICANT), MR. PRAKASH GAURISHANKAR MEHTA (GUARANTOR) to repay the amount mentioned in the notice being Rs. 25,52,691-40/- (RUPEES TWENTY FIVE LAKH FIFTY TWO THOUSAND SIX HUNDRED NINETY ONE & PAISE FORTY ONLY) as on 31/12/2019 with future interest and incidental charges w.e.f. 01/01/2020, Less credits, if any.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower / Guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 12<sup>th</sup> Day of JANUARY of the year 2021. The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the BANK OF BARODA (E-VIJAYA BANK) CHALTHAN BRANCH SHOP NO. 1 TO 5, SAI VATIKA OPP CHOKHADHANI HOTEL, SURAT GUJARAT-394305 for an amount of Rs. 25,52,691-40/- (RUPEES TWENTY FIVE LAKH FIFTY TWO THOUSAND SIX HUNDRED NINETY ONE & PAISE FORTY ONLY) as on 31/12/2019 with future interest and incidental charges w.e.f. 01/01/2020, Less credits, if any. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of Immovable property**  
**Block No. 137, Plot No 131, Raj Nandini Residency Vibhag-2, MOJE:VILLAGE : UMARA, TALUKA: OLPAD, DIST: SURAT, GUJARAT-394540**  
Boundaries : On the North by - SOCIETY BOUNDARY, On the South by - PLOT NO 130, On the East by - PLOT NO 116, On the West by - SOC. INTERNAL ROAD  
Date : 12/01/2021 Authorized Officer  
Place : Surat Bank of Baroda,

**DEBTS RECOVERY TRIBUNAL-I** R.C. No. 695 of 2018

Ministry of Finance, Department of Financial Service, Government of India  
2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad - 380006.

FORM NO. 22 (Earlier 62) [Regulation 37(1) DRT Regulations, 2015]  
[See Rule 52(1) of the Second schedule to the Income-tax Act, 1961]

**E - AUCTION / SALE NOTICE**  
**PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961**  
**READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993**

R.C. No. 261/2019 O. A. No. 267/2018

**Certificate Holder : BANK OF INDIA, BHADRA, AHMEDABAD**

**V/s.**

**Certificate Debtors : M/S.SUN-TEX ENGINEERS & OTHERS**

To,	CD No. 1	M/s. Sun-Tex Engineers, (Sole Prop. Mr. Hajarilal Chandranarayn Vaishya) Factory : 57, Soham Integrated Park, Village, Mahijada, Taluka-Daskroi, Dist : Ahmedabad Also at : 19, Mamta Estate, Nr. Prakash Estate, Vastral Road, Surelyya, Amraiwadi, Ahmedabad-380026.
	CD No. 2	Mr. Hajarilal Chandranarayn Vaishya (Proprietor) B/18, Harinagar Society, Gurukrupa School, Nr. Jagdish Park, CTM, Ahmedabad-380026.
	CD No. 3	Mr. Omkarnath Hajarilal Vaishya B/18, Harinagar Society, Gurukrupa School, Nr. Jagdish Park, CTM, Ahmedabad-380026.

The under mentioned property will be sold by Public E - Auction sale on 18th February 2021 for recovery of sum of Rs. 6,81,06,460=11 (Rupees : Six crores eighty one lacs six thousand four hundred sixty and paise eleven only)(Decree Amount) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT - I (less amount already recovered, if any), from M/s. SUN-TEX ENGINEERS & OTHERS.

**SCHEDULE OF PROPERTY**

No. of Lots	Description of the property to be sold with the names of the co - owners where the property belongs to defaulter and any other person as co - owners.	Reserve price below which the property will not be sold	EMD 10% of reserve price or Rounded off
1	Plant and machinery used for manufacturing of finished/unfinished products of textile machines lying and being at 57, Soham Integrated Park, Village, Mahijada, Taluka-Daskroi, Dist. Ahmedabad.	Rs. 17,00,000/-	Rs. 1,70,000/-
2	All the pieces and parcels of Sub Plot No. 57, Soham Integrated Park, admeasuring 4592.27 Sq. mtrs (Plot area) and 2445.23 sq mtr (Built up area-as per approved plans of Town Planner, Ahmedabad) standing thereon forming part of Block no. 192 (Old Survey No. 164, 186, 187, 188, 189, 190, 191, 192), paiki of Mouje Village : Mahijada, Taluka Daskroi, Dist : Ahmedabad and Old Sub-District of Ahmedabad-5 (Narol) and New Sub District of Ahmedabad - 5 (Narol) and New Sub District of Dmhedabad (Aslali) and situated at Village Mahijada, Tal., Daskroi, Dist : Ahmedabad : The same is bounded as follows : One or towards the North : By 12 Mts. Wide Road On of towards the south : By Sub Plot No. 45, On or towards the East : By Sub Plot No. 58, On or towards the West : By 18 Mts. Wide Road.	Rs. 3,70,00,000/-	Rs. 37,00,000/-
3	Tenement No. B/18, Harinagar Society, Nr. Jasodanagar, Jagdish Park, Gurukrupa School Road, CTM, Ahmedabad.	Rs. 48,00,000/-	Rs. 4,80,000/-
4	Tenement/Duplex No. A/8 Pushpak City Nr. Nayanaramya Club, Nr. Hathijan Circle, Mehmedabad Road, Ahmedabad bearing Block No. 676, 677, 678/A,		

